

Ref. No.: AEL/SEC/STOCK/2024-25

Date: - 22nd May, 2024

To,
The Manager, DCS-CRD
Corporate Relationship Department,
BSE Limited,
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street, Mumbai- 400 001

To,
The Listing Department, 5th Floor,
National Stock Exchange of India Limited,
"Exchange Plaza",
Bandra-Kurla Complex,
Bandra (East), Mumbai-400 051

SECURITY CODE: 509009 | SECURITY ID: AUSOMENT | ISIN: INE218C01016 | SERIES: EQ

Dear Sir/Madam,

Sub.:- Newspaper Publication - Submission of the copy of the newspaper cutting of the extract of Audited Standalone and Consolidated Financial Results for the quarter and financial year ended 31st March, 2024.

As per Regulations 33 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed copies of newspaper cutting of the extracts of Audited Standalone and Consolidated Financial Results of the Company for the quarter and financial year ended 31st March, 2024 which were published in English newspaper "THE INDIAN EXPRESS" and in Vernacular newspaper "FINANCIAL EXPRESS" on 22nd May, 2024.

You are therefore requested to take note of the same.

Thanking you,

For, AuSom Enterprise Limited

Ravikumar Pasi Company Secretary &

Compliance Officer

Encl: As Above



Correspondence Address : 606 "SWAGAT", Near Lal Bungalow, C.G.Road, Ahmedabad-380 006. Phone : +91 79 2642 1422-1499 Fax : +91 79 2656 9898 E-mail : ausom.ael@gmail.com www.ausom.in

Registered Office : 11-B, New Ahmedabad Industrial Estate, Sarkhej-Bavla Road, Village - Moraiya - 382 213. Dist. Ahmedabad, Gujarat, INDIA • CIN : L67190GJ1984PLC006746

### Ahmedabad sizzle at 45° Celsius

PRESS TRUST OF INDIA AHMEDABAD, MAY 21

AMID HEATWAVE conditions prevailing in several parts of Gujarat, Ahmedabad and Gandhinagar on Tuesday recorded a maximum temperature of 45 degrees Celsius, the highest in the state, the India Meteorological Department (IMD) said.

Maximum temperatures in several cities such as Raikot. Bhavnagar, Vadodara, Vallabh Vidyanagar, Surendranagar, Keshod, Mahuva and Bhuj were above 40 degrees Celsius, it added.

Heatwave conditions continued to prevail at isolated pockets in the districts of the Saurashtra region such Junagadh, Bhavnagar and Porbandar, and in Gandhinagar and Anand districts of north Gujarat, said IMD.

As per an IMD forecast, parts of Ahmedabad and Gandhinagar, among several districts in Gujarat, were likely to be in grip of heatwave conditions, which will increase likelihood of heatrelated illnesses.

The Ahmedabad Municipal Corporation (AMC) said maximum temperature in the city was likely to hover around 45 degrees Celsius till the next five

Amid a surge in day temperatures, government hospitals witnessed a sudden rise in the number of patients coming with symptoms of heat-related illnesses caused by exposure to sun. The AMC has equipped health and wellness centres with medicines and ORS (oral rehydration solution) packets to help fight heat-related health complications. It has also set up kiosks across the city for distribution of butter milk and made arrangements for drinking water at public places, said the civic body in a statement.

#### Gandhinagar, 4 ARRESTED IN AHMEDABAD FOR IS LINKS

## Pak-based handler was to give time, location of attack, accused tell cops

**PRESSTRUST OF INDIA** AHMEDABAD, MAY 21

FOUR SUSPECTED terrorists from Sri Lanka arrested in Ahmedabad have told the investigators that their Pakistan-based handler was going to give them the exact location and time to carry out the attack after they collected the weapons dropped for them, an official said Tuesday.

The four were detained from Ahmedabad airport on Sunday night by the Gujarat Anti-Terrorist Squad (ATS) after they landed here to carry out terrorist activities at the behest of Islamic State following the directions of their Pakistan-based handler.

The ATS had also seized three pistols and 20 cartridges abandoned at a location in Nana Chiloda of Gandhinagar on the basis of geo coordinates found on a mobile phone seized from their possession.

"So far during the interrogation, they have refused to reveal as to where exactly they were planning to carry out the terrorist attack," Superintendent of Police

The four were detained from Ahmedabad airport on Sunday night by Gujarat ATS. File

(SP), ATS, Sunil Joshi told media

All they have said so far is that their handler was going to inform them about the exact location and time of the target after they collected the weapons," he said.

The terrorists were taken into a 14-day police remand and were being questioned by the ATS officials regarding their plans. The investigating agency was also trying to find out about the persons who were supposed to help them in India in meeting their objectives, Joshi said.

"Forensic extraction of data of their phone devices is underway. Details are being sought from the communication applications found on their mobile phones, through which they stayed in touch with their Pakistani handler." Ioshi said

He said that drop points on their mobile phones were also being technically analysed and efforts are being made to find out if

**KAMAALSAIYED** 

EXPORT OF gems and jewellery

from Surat's Special Economic

Zone (SEZ) at Sachin fell by half in

terms of value in the just-con-

cluded financial year when com-

pared to 2022-23. The traders

blamed this on the fall in demand

on account of the Russia-Ukraine

and Israel-Hamas wars, as well as

the crackdown on gold smuggling

by the Directorate of Revenue

From diamonds, gems and

jewellery exports worth Rs

26,513.07 crore in 2022-23, the

number fell to Rs 12.765.44 crore

this year. In 2020-21, the exports

were worth Rs 16,161.65 crore,

among the overall exports worth

Rs. 17845.55 crore recorded by

ational units, is the only SEZ for

gems and jewellery export apart

from the diamond bourse. Among

these, 80 units are into manufac-

turing of diamonds, gems and

turer and former Gujarat Region

chairman of Gems and Jewellery

Export Promotion Council

(GJEPC), Dinesh Navadiya, said:

"There are a few major reasons be-

hind the dip in exports of dia-

mond, gems and jewellery. These

are the Russia-Ukraine and Israel-

Hamas wars, inflation in the US

that is a major consumer, China

struggling to get over its Covid-19

impact and strict action taken by

DRI and other agencies against

firms in the SEZ that are giving

fake export figures while selling

In the last four years, the Surat

DRI has booked seven units in this

Place: Ahmedabad

goods in the domestic markets."

Veteran diamond manufac-

jewellery products.

The Surat SEZ, with 121 oper-

Intelligence (DRI).

the SEZ.

SURAT. MAY 21

Dip in export of

from Surat SEZ

gems and jewellery

there were others who were supposed to help them carry out their objective. Joshi said that since the accused persons are from another country and arrived in Ahmedabad via Tamil Nadu, police of other states and central investigation and intelligence agencies have also joined the probe.

The accused have been identified as Mohammad Nusrat (35), Mohammad Faarukh (35), Mohammad Nafran (27) and Mohammad Rasdeen (43).

Director General of Police Vikas Sahay said the men travelled to India to carry out terror activities at the behest of the Islamic

The men told the investigators that they were earlier associated with the banned Sri Lankan radical militant outfit. National Thowheeth Jamath (NJT), and joined the IS after getting in touch with Pakistani handler 'Abu'.

The men were booked under the Unlawful Activities Prevention Act (UAPA), Indian Penal Code (IPC) and the Arms Act.

Sri Lanka to probe Meanwhile, Colombo has

Fall due to dip in

Russia-Ukraine and

Israel-Hamas wars,

on gold smuggling

Ahmedabad.

and the DRI crackdown

connection. In March and April

this year, the DRI has lodged 16

cases of gold smuggling across the

country, including one in

Chairman Vijay Mangukiya said,

"The reason behind exports going

down in the diamond, gems and

jewellery segment is that there is

no major demand in the interna-

tional market. Also, the ongoing

wars and the sanctions laid by G7

nations on Russian diamonds

over 35 per cent of rough dia-

Alrosa diamond company. Due to

the ban on Russian diamonds,

there is shortage of rough dia-

monds in the Indian market. Even

the prices of lab-grown diamonds

amond, gems and jewellery have

gone down to 30 per cent, he

added. According to Surat SEZ

data, while the pharma and

chemical segment has seen a rise

in exports since 2020-21, exports

have dipped in the textile and gar-

ment, plastic and rubber as well

as software and services seg-

ments. The medical equipment

and device segment has seen a

rise in exports along with the en-

export of tobacco products, mean-

while, has dipped.

gineering products segment. The

Overall, the production of di-

have gone down."

"The Indian market consumes

have led to dip in exports."

GJEPC (Gujarat Region)

demand due to

tain information on the four arrested, a media report said on Tuesday. Sri Lanka's state intelligence has asked for further information from its Indian counterpart to verify the background of the suspects and probe their links to the IS, the Daily Mirror newspaper reported.

Sri Lankan authorities will "immediately investigate" to take further action once the information is obtained, the newspaper said, citing sources. Public Security Minister Tiran Alles and Inspector-General of Police (IGP) Deshabandu Tennakoon said they were taking these reports seriously and closely monitoring the developments.

Alles and Tennakoon said they would initiate discussions with Indian authorities to gather detailed information about the suspects and their activities, the report said.

"We are working in close coordination with our Indian counterparts to ensure that all necessary measures are taken to address any potential threat," Alles was quoted as saying.

#### Three booked for robbing diamond trader of Rs 50.89 lakh

**EXPRESS NEWS SERVICE** SURAT, MAY 21

Three persons, including a diamond broker, were booked on Monday by the Mahidharpura police in Surat for allegedly robbing a diamond trader of Rs 50.89 lakh.

The police identified the complainant as Praful Malaviya, who runs diamond trading office 'Dhanani Exports' at Mahidharpura. He accused Harsh Mehta, Laxman Munia and Bharat Prajapati, all residents of Surat, of cheating.

Malaviya alleged that Mehta came to his house last December and arranged a phone call from men who posed as diamond merchants. He added that Mehta also  $made\,Malaviya\,talk\,to\,Munia\,and$ Prajapati over the phone, who posed as diamond buyers.

Following this, Malaviya handed over polished natural diamonds weighing 316.34 carat, worth Rs 65.39 lakh, to Mehta. The FIR said that after a few days, when Malaviya started demanding payment for the diamonds Mehta paid Rs 14.5 lakh and sought a few weeks to pay the rest.

According to Malaviya, when he contacted Mehta in February and March for payment of pending dues, Mehta initially made excuses and then stopped speaking to him. Following this, Malaviya approached the police.

Mahidharpura police Inspector JB Chaudhary said, "We have registered a case on the basis of Praful Malaviya's statement. We are looking for Harsh who stays both in Ahmedabad and Surat... Laxman and Bharat reside in Surat. We will also record their statements."

The accused were booked under various sections of the IPC including for cheating and criminal conspiracy.

## After remaining low for month, cumin seed prices recover



Cumin seeds being auctioned at Unjha APMC. Express

#### **GOPALKATESHIYA** RAJKOT, MAY 21

AFTER WITNESSING a dip for around a month, jeera (cumin seeds) prices have rebounded and recovered to around Rs 30,000 per quintal (Rs 300 per kg) in agricultural produce market committees (APMCs) mandis in Gujarat, logging a gain of around Rs10,000 over the last one week.

At Unjha APMC in Mehsana the world's largest wholesale market of cumin seeds – prices had crashed to around Rs 20,000 mid-April from the average Rs 25,000 in the preceding two months. The prices remained at Rs 20,000, as marketing season peaked and arrivals remained stable at average 30,000 bags (each containing 55 kg of jeera). However, over the past week or so, the prices have recovered to the average Rs 30,000.

The markets attributed the recovery to smart-selling decisions by farmers. "Farmers refused sell at prices that were lover than the cultivation cost. This reduced supply in the market as traders had remained hesitant to purchase for stocking, thinking a bumper crop will keep prices low. All this while, demand of this spice seed remained stable, pushing the price up one more time," Piyush Patel, president of Unjha APMC Vepari Association, the association of traders of Unjha APMC mandi, said.

Arrivals in Unjha APMC were around 38,000 bags on Tuesday. "Jeera prices in domestic market

have also been cushioned by a sustained overseas demand. Exporters are exporting cumin at average rate of Rs 31,500... they are saying that export volumes are also one-and-a-half times higher than the previous year," Patel added. He further said that the price volatility may continue. "The market is going to remain tight and predicting a long term trend looks a risky business."

Farmer leaders welcomed the upswing in the price. "Given the higher cultivation costs this year, farmers can't afford to sell jeera below Rs 25,000. Once the prices slid to Rs 20,000, farmers were forced to hold their harvest back. In the meantime, traders who had purchased jeera at around Rs 30,000, started selling in the open market, assuming prices will slide further due to a bumper harvest. That kept prices low for weeks. While there could be some speculation at play even now, the upswing in prices bodes well for farmers," Dinesh Patel, Chairman of Unjha APMC said.

Guiarat, the largest ieera producer of India, had seen area under jeera cultivation going up to 5.61 lakh hectares (lh) in 2023-24 Kharif season from a mere 2.75 lh the previous year, as prices hit peak of around Rs 65,000 per quintal in June-July 2023.

Rajasthan, the state with largest jeera acreage, also saw an increase in its cultivation area of this crop. As per the Third Advance Estimates of Gujarat government, jeera production in the state was 4.01 lakh tonnes or 40.10 lakh quintal.



#### Infighting Continues

 $THE \, BIP'S \, Vado dara\, unit, which \, had \, left \, the \, party \, embarrassed$ with its infighting during the Lok Sabha polls, is yet to iron out its differences. The latest animosity comes from the Vadodara Municipal Corporation (VMC), where the corporators are speaking up against Standing Committee Chairman Dr Sheetal Mistry's decision to conduct "inspections" of pre-monsoon works. Mistry, who is in his first tenure as the standing committee chairman, has been inspecting pre-monsoon works ward-wise for over a week. However, corporators have been left out of the site visits leading to much "sourness". On Monday, Mistry and Mayor Pinky Soni arrived in Ward No 17, represented by BIP's whip in VMC Shailesh Patil. Later. Patil claimed that he was "unaware" about Mistry's visit and had not been called for the inspections. "We are the local representatives and if we are taken into confidence, we can tell the chairman what the issues on the ground are that he is not aware of. I learnt about his visit from the news channels and it is not an ideal way to conduct a pre-monsoon inspection," Patil told mediapersons.

#### Congress' family afraid of visiting Statue of Unity: PM in Prayagraj

Prayagraj: In a swipe at the Congress, Prime Minister Narendra Modi Tuesday said the Opposition party wants to give the entire credit for India's freedom to "one family" which is "afraid" to even visit the 'Statue of Unity' of its leader Sardar Vallabhbhai Patel in Kevadia.

'The 'shezaadee' (princes) of SP and Congress cannot see anything beyond their family," Modi said addressing an election rally in Prayagraj. 'The Congress wants to give the entire credit for (India's) freedom) to one family. You know about the Statue of Unity — the statue of Vallabhbhai Patel in Gujarat. This is the tallest statue in the world. Sardar Patel was from the Congress. Modigot the statue made. But, this family of the Congress has not gone there. They are afraid that trouble will befall them if even the shadow of the statue falls on them," Modi said.

#### Chalala, Tal-Dhari, Dist-Amreli 365630 POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorized Officer of the State Bank of India under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of security Interest Act, 2002 and In exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest(Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 20.06.2023 calling upon the Borrower Mr. KAMLESH MANSURBHAI MAKWANA and Guarantor Mr ASHOKBHAI MANSURBHAI MAKWANA to repay the amount mentioned in the notice being Rs. 8,46,146.00/ (Rupees Eight Lakh Forty Six Thousand One Hundred and Forty Six only) as on 20.06,2023 including accrued interest and further interest from 20.06.2023(Date) within 60 days from the date of receipt of said notice. The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor and the public

in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this 6<sup>th</sup> day of Sep The Borrowers/Guarantors in particular and the public in general are hereby cautioned not to deal with the

property and any dealing with the property will subject to the charge of the State Bank of India, for an amount Rs. 8,46,1,46/- (Rupees Eight Lakh forty six thousand one hundred and forty six rupees Only) as on 20.06.2023 with further at the contractual rate, other cost and charges thereon.

The borrower's attention is invited in provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the immovable property

Property owned by Shri ASHOKBHAI MANSURBHAI MAKWANA AND SHRI KAMLESHBHAI MANSURBHAI MAKWANA , property consists of residential building in R S No 177 Paiky , Plot No 4 Paiky "JAY DANEV", Panchvati society, Near Maruti Nagar Amreli Road Chalala Tal Dhari Dist Amreli.

**Boundaries:** 

East: Plot No 8 West: 6.00 mtr wide road North: Property of LakhmanbhaiNimavat South: Plot No 4 Paiki

Date 06/09/2023 Place Chalala

**Authorized Officer** State Bank Of India

#### **HIGH COURT OF GUJARAT SOLA, AHMEDABAD**

Recruitment in High Court of Gujarat, District Courts, **Industrial Court and Labour Courts** Advertisement No. HCG/NTA/01/2024

The Gujarat High Court is the High Court of the State of Gujarat. It has jurisdiction over the entire State of Gujarat.

The High Court of Gujarat intends to fill up various posts including anticipated posts on Direct Recruitment basis in the High Court of Gujarat, District Courts, Industrial Courts and Labour Courts under Recruitment Drive - 2024. Details are given as under:

#### [I] High Court of Gujarat

SI. No.	Post Name	Tentative No. of Vacancies
1.	English Stenographer Grade II	54
2.	Deputy Section Officer	122
3.	Computer Operator (IT Cell)	148
4.	Driver	34
5.	Court Attendant	208

#### Court Manager [II] District Courts, Industrial Courts and Labour Courts

SI. No.	Post Name	Tentative No. of Vacancies				
1.	Gujarati Stenographer Grade -II	204 + 10 = 214				
2.	Gujarati Stenographer Grade -III	267 + 40 = 307				
3.	Process Server/ Bailiff	198 + 12 = 210				

Number of tentative vacancies of posts concerned are mentioned in the bracket. All other necessary details with regard to recruitment to the said posts will be made available on the Official Website(s) of the National Testing Agency on https://exams.nta.ac.in/HCG/ and / or High Court Website viz. https://gujarathighcourt.nic.in/ and https://hcojas.gujarat.gov.in and also on the Notice Section / Notice Board of the National Testing Agency, High Court of Gujarat and all the District Courts. Interested applicants are advised to regularly visit above Official

High Court of Gujarat, Sola, Ahmedabad - 380 060. davp 21354/11/0001/2425

Websites for latest updates.

Registrar (Recruitment)



Regd. Office: - 11-B, New Ahmedabad Industrial Estate, Village:-Moraiya, Sarkhej-Bavla Road, Ahmedabad-382 213. CIN: L67190GJ1984PLC006746 Phone: +91 79 2642 1422-1499 Fax: +91 79 2656 9898 E-mail: ausom.ael@gmail.com Website: www. ausom.in.

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2024

								(F	RS. IN LAKHS)
STANDALONE				CONSOLIDATED					
Quarter ended 31.03.2024 Audited	Quarter ended 31.12.2023 Unaudited	Quarter ended 31.03.2023 Audited	Year ended 31.03.2024 Audited	Year ended 31.03.2023 Audited	Quarter ended 31.03.2024 Audited	Quarter ended 31.12.2023 Unaudited	Quarter ended 31.03.2023 Audited	Year ended 31.03.2024 Audited	Year ended 31.03.2023 Audited
71019.80	19723.53	13096.30	97617.78	18408.76	70948.53	19723.53	13096.30	97546.51	18408.76
516.93	178.63	(230.75)	1100.53	155.08	367.41	119.69	(464.86)	1100.53	155.08
516.93	178.63	(230.75)	1100.53	155.08	367.41	119.69	(464.86)	1100.53	155.08
431.93	146.63	(200.50)	915.53	120.33	282.41	87.69	(434.61)	915.53	120.33
1	146 63	(200 25)	915 56	120.58	282 44	87 69	(434 36)	915 56	(120.58)
1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36	1362.36
			11125.52	10278.06				11125.52	10278.06
3.17 3.17	1.08 1.08	(1.47) (1.47)	6.72 6.72	0.88 0.88	2.07 2.07	0.64 0.64	(3.19)	6.72 6.72	0.88 0.88
	ended 31.03.2024 Audited 71019.80 516.93 431.93 431.96 1362.36	Quarter ended 31.03.2024         Quarter ended 31.12.2023           Audited         Unaudited Unaudited 19723.53           516.93         178.63           516.93         178.63           431.93         146.63           431.96         146.63           1362.36            3.17         1.08	Quarter ended 31.03.2024         Quarter ended 31.12.2023         Quarter ended 31.03.2023           Audited         Unaudited         Audited           71019.80         19723.53         13096.30           516.93         178.63         (230.75)           516.93         178.63         (230.75)           431.93         146.63         (200.50)           431.96         146.63         (200.25)           1362.36         1362.36         1362.36                3.17         1.08         (1.47)	Quarter ended 31.03.2024         Quarter ended 31.03.2023         Quarter ended 31.03.2023         Year ended 31.03.2024           Audited         Unaudited         Audited         Audited         Audited           71019.80         19723.53         13096.30         97617.78           516.93         178.63         (230.75)         1100.53           431.93         146.63         (200.50)         915.53           431.96         146.63         (200.25)         915.56           1362.36         1362.36         1362.36         1362.36              11125.52           3.17         1.08         (1.47)         6.72	Quarter ended 31.03.2024         Quarter ended 31.03.2023         Year ended 31.03.2024         Year ended 31.03.2023           Audited         Unaudited         Audited         Audited	Quarter ended 31.03.2024         Quarter ended 31.03.2023         Year ended 31.03.2024         Year ended 31.03.2024         Quarter ended 31.03.2024         Audited Since Sin	Quarter ended 31.03.2024         Quarter ended 31.03.2024         Quarter ended 31.03.2023         Year ended 31.03.2024         Quarter ended 21.03.2023         Quarter ended 31.03.2024         31.12.2023           4319.80         178.63         (230.75)         1100.53         155.08         367.41         119.69           431.93         146.63         (200.50)         915.53         120.33         282.41         87.69           431.96         146.63         (200.25)         915.56         120.58         282.44         87.69           1362.36         1362.36         1362.36         1362.36         1362.36         1362.36         1362.36	Quarter ended 31.03.2024         Quarter ended 31.03.2023         Quarter ended 31.03.2023         Year ended 31.03.2024         Quarter ended ended 31.03.2023         Quarter ended 31.03.2023         Quar	STANDALONE   CONSOLIDATED   CONSOLIDATED

Note:- The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter/Annual Financial Results are available on the stock exchange websites at www.bseindia.com, www.nseindia.com and on For AUSOM ENTERPRISE LIMITED company's website www.ausom.in

> KISHOR P. MANDALIA MANAGING DIRECTOR

# સોના-ચાંદીના ભાવો વિક્રમજનક એસબીઆઇના ચેરમેન પદ માટેના ઊંચી સપાટી પરથી પાછા પડયા ઈન્ટરલ્ય મો

નવી દિલ્હી, તા. ૨૧

નબળા વૈશ્વિક વલણો અને નફો ગાંઠે બાંધવાને પગલે સોનં રા.૫૫૦ તીવ્ર ઘટવાની સાથે આજે નવી દિલ્હીમાં સોન ચાંદીના ભાવો વિક્રમજનક ઊંચા સ્તરથી પાછા પડ્યા હતા. એચડીએફસી સિક્યોરિટીસ અનુસાર યુએસ ફેડરલ રિઝર્વ સભ્યોમાથ એકની આક્રમક ટિપ્પણી દ્વારા અસરથી સોનાના ભાવ અસર પામ્યા હતા, જેમણે ભલામણ કરી ા.૧,૬૦૦ હતી કે વ્યાજ દરોને ફુગાવાને ા.૯૪,૫૦૦ના સ્તરે બંધ થયા વીપી પ્રણવ મેરે જણાવ્યું હતું હાલના સ્તરમાં રાખવાની જરૂર રહેશે. હતી. સોનાના ભાવ રા.૫૫૦ ઘટીને રૂા.૭૪,૬૫૦ના સ્તરે બંધ હાજર સોનાના ભાવ

તે પાછલા સત્રમાં ૩ ૨૨ ડોલર ઘટીને ૨.૪૨૦

ા.૭૫,૨૦૦ના સ્તરે બંધ થયા ડોલરના સ્તરે ટ્રેડ થયા હતા. કે આવેલા ડેટાએ આર્થિક જેએમ ચાંદીના ભાવ પણ રૂ સર્વિસિસ અને બ્લિંકએક્સમાં રહેલા ફ્રગાવાના સંકેતો



રૂ રિસર્ચ (કોમોડિટી અને ચલણ) ઘટીને

આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સમાં પાછલા સ્તરથી

ટેકો લાવવા લાંબા સમય માટે હતા. તે પાછલા સત્રમાં રૂ ચાલુ ા.૯૬,૧૦૦ના સ્તરે બંધ થઇ

ફાયનાન્સિયલ કામગીરીમાં ઘટાડા સાથે ઘટી દર્શાવ્યા પછી ફ્રેડરલ રિઝર્વ દ્વારા વહેલા દર કાપ માટે વધી રહેલી બેટ વચ્ચે ગતિ હકારાત્મક રહી હતી. નિષ્ણાતો અનુસાર ટ્રેડરો બુધવારના રોજ જારી થનાર ફેડરલ ઓપન માર્કેટ કમિટી (એફઓએમસી)

> કાર્યનોંધ સાથે વિવિધ ફેડ અધિકારીઓને ટિપ્પણી પર નજીકથી નજર રાખશે, જે ફેડ સૂત્રોએ જણાવ્યું હતું. સ્થગિત (એફએસઆઇબી) નાણાં નીતિ દેખાવ પર વધુ રાખવાનાં ચોક્કસ કારણો તરત જ આંતરદ્રષ્ટી પુરી પાડશે.

નવી દિલ્હી, તા. ૨૧

માલિકીની બેંકો અને નાણાંકીય સંસ્થાઓના ડિરેક્ટર્સ માટેના હેડહન્ટર એ એક અનપેક્ષિત પગલામાં એસબીઆઇના ચેરમેન પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી માટે નિર્ધારિત ઈન્ટરવ્ય મુલતવી રાખ્યો છે. છેલ્લી ઘડીએ મોકુફ રાખવામાં આવેલી આ કલાકો અગાઉ આવી છે, એમ

ઘટના નિર્ધારિત ઈન્ટરવ્યૂના કરવામાં આવશે. ફાઇનાન્સિયલ ચેરમેન પદ માટેની ઉપલી સર્વિસીસ ઈન્સ્ટિટ્યૂશન્સ બ્યુરો વયમર્યાદા છે. સંમેલન અનુસાર, દિનેશ ચેરમેનની

જણાવ્યું હતું કે, ઈન્ટરવ્યૂની નવી નક્કી કરશે, જેઓ ૨૮ ઓગસ્ટના આવે છે. એફએસઆઇબી નામની તારીખ ૪ જુન પછી નવી રોજનિવૃત્ત થશે, જ્યારે તેઓ ૬૩ ભલામણ કરશે અને અંતિમ એફએસઆઇબી સરકારી સરકારની રચના બાદ નક્કી વર્ષના થશે, જે એસબીઆઇના નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર



ખારાના રિપ્લેસમેન્ટની પસંદગી એસબીઆઈના જાણી શકાયા નથી. જોકે, સૂત્રોએ કરવા માટે અગાઉથી ઈન્ટરવ્યૂ ડિરેક્ટર્સના પૂલમાંથી કરવામાં છે.

નિમણંક મેનેજિંગ

અધ્યક્ષતાવાળી મોદીજીની કેબિનેટની નિમણંક સમિતિ દ્વારા લેવામાં આવશે. એફએસઆઇબીનું नेतृत्व ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (ડીઓપીટી)ના પૂર્વ સચિવ ભાનુ પ્રતાપ શર્મા કરી રહ્યા છે. સરકાર દ્વારા નિયુક્ત પસંદગી પેનલના સભ્યોમાં નાણાંકીય સેવા સચિવ, જાહેર સાહસો વિભાગના સચિવ અને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરનો સમાવેશ થાય

**Daia** consumer care

**Bajaj Consumer Care Limited** 

CIN: L01110RJ2006PLC047173

Regd. Office: Old Station Road, Sevashram Chouraha, Udaipur 313 001, Rajasthan Phone: +91 0294-2561631-32 ● Website: www.bajajconsumercare.com Email: complianceofficer@bajajconsumer.com

#### <u>NOTICE OF POSTAL BALLOT AND REMOTE EVOTING INFORMATION</u>

Members are hereby informed that pursuant to provisions of Section 108 an Section 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("the Act") read with Rule 20 and Rule 22 of Companies (Management and Administration) Rules, 2014, as amended, Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ("Listing Regulations") read together with the General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020, 22/2020 dated June 15 2020, 33/2020 dated September 28 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022, 11/2022 dated December 28, 2022 and 09/2023 dated September 25, 2023 respectively issued by the Ministry of Corporate Affairs ("MCA") (hereinafter collectively referred to as "MCA Circulars") Secretarial Standard on General Meetings ("SS-2") issued by the Institute of Company Secretaries of India and any other applicable law, rules and regulations (including any statutory modification(s), amendment(s), clarification(s), substitution(s) or re-enactment(s) thereof for the time being in force), the approva of the members of Bajaj Consumer Care Limited (the "Company") is sought for the following Special Resolution(s) as set out in the Postal Ballot Notice dated May 8 2024 ("the Notice") by way of remote e-voting ("e-voting") process only:

		•
Sr.	Agenda of the Notice	Type of
No.		Resolution
1.	Approval for buyback by the Company of its fully paid-up equity shares having a face value of INR 1/- each ("Equity Shares"), not exceeding 57,41,000 Equity Shares (representing 4.02 % of the total number of Equity Shares in the total paid-up equity capital of the Company as of March 31, 2024), at a price of INR 290/- per Equity Share payable in cash for an aggregate amount not exceeding INR 16,649 lakhs.	

In compliance with the requirements of the MCA Circulars, the hard copy of the Notice along with Postal Ballot Forms and pre-paid business reply envelope has not been sent to the Members for this Postal Ballot and Members are required to communicate their assent or dissent through the remote e-voting system only. The Notice can be downloaded from the website of the Company at www.bajajconsumercare.com, and website of Stock Exchanges where shares of the Company are listed i.e. BSF Limited ("BSE") at www.bseindia.com and National Stock Exchange of India Limited ("NSE") at www.nseindia.com, and on the website of KFin Technologies Limited ("KFINTECH") at https://evoting.kfintech.com.

Pursuant to the MCA circulars, the Company has completed the dispatch of electronic copies of the Postal Ballot Notice along with the explanatory statement on Tuesday, May 21, 2024 through electronic mode to those members whose email addresses are registered with the Company/Depository Participant(s) as on May 17, 2024 ("Cut-off date").

A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owner maintained by the Depositories as on the Cut-off Date shall only be entitled to avail the facility of remote e-voting. The voting rights of the Members shall be in proportion to the paid-up value of their shares in the total voting capital of the Company as on the Cut-off Date. A person who is not a member on Cut-off Date shall treat this Notice for information purposes only. The detailed instructions and information relating to e-voting are set out in the Notice sent to the Members.

The Company has entered into an arrangement with KFINTECH for facilitating remote e-voting to enable the Members to cast their votes electronically pursuant to Regulation 44 of the Listing Regulations through e-voting facility via https://evoting.kfintech.com.

The facility to exercise vote on postal ballot by remote e-voting, will be available for

he following period:							
Commencement of e-voting period	9:00 a.m. IST on						
•.	Wednesday, May 22, 2024						
Conclusion of e-voting period	5:00 p.m. IST on						
	Thursday, June 20, 2024						
Cut-off date for eligibility to vote	Friday, May 17, 2024						

Remote e-voting shall not be allowed after 5:00 P.M. on Thursday, June 20, 2024 and e-voting module shall be disabled thereafter.

Members who have not updated their e-mail addresses are requested to registe the same in respect of shares held by them in electronic mode with their relevan Depositories through their Depository Participants and in respect of shares held in physical mode by writing to Company's Registrar and Transfer Agent, KFin Technologies Limited, either by e-mail to einward.ris@kfintech.com or by post to Selenium Tower B, Plot No.31 & 32, Financial District, Nanakramguda, Serillingampally, Hyderabad 500032.

The Board of Directors of the Company has appointed Mr. S.N. Viswanathan (ACS 61955, COP 24335), failing him Ms. Malati Kumar (ACS 15508, COP 10980) Partners of S.N. Ananthasubramanian & Co., Practicing Company Secretaries, as the scrutinizer ("Scrutinizer") for conducting the e-voting process in a fair and transparent manner.

In case of any queries/issues, members may contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at 022-48867000/24997000 and CDSI helpdesk at helpdesk.evoting@cdslindia.com or call at toll free no. 1800 22 55 33 or write an email to compliance officer@bajaiconsumer.com.

The Scrutinizer will submit his report to the Chairman or the Company Secretary after the completion of scrutiny of the e-voting and the result will be announced within 48 hours from the conclusion of e-voting i.e. not later than 5:00 p.m. IST on Saturday, June 22, 2024 and will also be displayed on the Company's website (https://www.bajajconsumercare.com/general-meetings-postal-ballots-agm.php) and on the website of KFINTECH (https://evoting.kfintech.com) and communicated to the stock exchanges.

For any queries or grievances pertaining to e-voting, shareholders are requested to contact Ms. C Shobha Anand, Deputy Vice President, KFin Technologies Limited, Selenium Tower B, Plot No.31 & 32, Financial District, Nanakramguda Serillingampally, Hyderabad 500032. Contact details: E-mail id: einward.ris@kfintech.com, contact number 1800 309 4001.

Date: May 22, 2024 Place: Mumbai

For Bajaj Consumer Care Limited Vivek Mishra Head-Legal & Company Secretary Membership No.: A21901



Place: New Delhi

Date: May 21, 2024

## AuSom Enterprise Limited

Regd. Office: - 11-B, New Ahmedabad Industrial Estate, Village:-Moraiya, Sarkhej-Bavla Road, Ahmedabad-382 213. CIN: L67190GJ1984PLC006746 Phone: +91 79 2642 1422-1499 Fax: +91 79 2656 9898 E-mail: ausom.ael@gmail.com Website: www. ausom.in

STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2024 (RS. IN LAKHS) STANDAL ONE CONSOLIDATED Quarter Quarter Quarter Year Quarter Quarter Quarter Year Year Year **Particulars** ended 31.03.2024 31.12.2023 31.03.2023 31.03.2024 31.03.202 31.03.202 31.12.2023 31.03.2023 31.03.202 1.03.2023 Audited Unaudited Audited Audited Audited Audited Unaudited Audited Audited Audited Total Income from Operations 71019.80 19723.53 13096.30 97617.78 18408.76 70948.53 19723.53 13096.30 97546.51 18408.76 Net Profit / (Loss) for the period 178.63 1100.53 119.69 (before Tax, Exceptional and/or Extraordinary items) 516.93 (230.75)155.08 367.41 (464.86)1100.53 155.08 Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 178.63 (230.75)(464.86)155.08 Net Profit / (Loss) for the period after tax 915.53 (after Exceptional and/or Extraordinary items) 431.93 146.63 (200.50)120.33 282.41 87.69 (434.61)915.53 120.33 Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax) 146.63 (200.25)915.56 120.58 282.44 87.69 (434.36)915.56 (120.58)Equity Share Capital (FV of Rs. 10/- each) 1362.36 1362.36 1362.36 1362.36 1362.36 1362.36 1362.36 1362.36 1362.36 1362.36 11125.52 10278.06 11125.52 10278.06 Other Equity Earnings Per Share (of Rs. 10/- each) (For continuing and discontinued operations) (not annualized) (3.19) (3.19) 6.72 6.72 Basic: 3.17 1.08 (1.47)6.72 0.88 2 07 0.64 0.88 3.17 1.08 (1.47)6.72 2.07 0.64 0.88 Diluted 0.88

Note:- The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter/Annual Financial Results are available on the stock exchange websites at www.bseindia.com, www.nseindia.com and on KISHOR P. MANDALIA

Place: Ahmedabad Date: 21/05/2024

Bandhan રીજનલ ઑફિસ: નેતાજી માર્ગ, મીઠાખળી છ રસ્તા પાસે, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬. ફોન: ૨૬૪૨૧૬७૧ એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬. ફોનઃ ૨૬૪૨૧૬७૧-७૫

#### બાકીદારો માટે માંગણાની નોટિસ

નીચે જણાવેલ ખાતું એન.પી.એ. માં પરિવર્તિત થયેલ છે અને બંધન બેંક દ્વારા સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ (ધ એક્ટ), ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ નીચે જણાવેલ કર્જદારોને ડિમાન્ડ નોટિસ જારી કરવામાં આવેલ હતી જે પરત ફરી છે. આથી આપ તમામને અને જાહેર જનતાને મોટા પ્રમાણમાં આ પ્રકાશન દ્વારા નોટિસ જારી કરવામાં આવે છે. (1) -

लान लनारनु नाम, सन लान जाता न.	मागर् ४२त ।मत४तनु परान (।स५चा५ अस८)	તારીખ/NPA તારીખ	ાડમાન્ડ નાટસના તારાખ બાકી રહેતી રકમ (રૂા.માં)	નારસ લગાવ્યાના તારીખ
શ્રી જીતેન્દ્રકુમાર અરવિંદભાઈ પટેલ કુ.સુનીતાબેન જીતેન્દ્રકુમાર પટેલ ૨૦૦૦૧૦૯૦૦૦૧૪૨૪	તમામ ચલ અને અચલ સંપત્તિ જે ૩૫ ચો.મીટર સર્વે નં.૮૧૬ પૈકી ૧, પ્લોટ નં.૨૦, ફ્લેટ નં.૨૦૫, બીજો માળ, પાવન રેસીકેન્સી, વિવેકાનંદ સોસાયટી પાસે, ચોઈલા રોક, મુ–બાયક, તા–બાયક જિ.–અરવધી ૩૮૩૩૨૫ સ્થિત છે અને જે આવરિત છેઃ ઉત્તરઃ ખુલી જમીન, પૂર્વઃ ફ્લેટ નં.૨૦૬, પશ્ચિમઃ ફ્લેટ નં.૨૦૪, દક્ષિણઃ સામાન્ય માર્ગ	२५.०४.२०२४/ 03.१०.२०२३	<b>૱</b> .૧, <i>૬</i> ૯,૪૩૮.७૮	૧૫.૦૫.૨૦૨૪
શ્રી.અહેમદભાઈ રહેમાનભાઈ વણજારા કુ.સુગરાબેન અહેમદભાઈ વણજારા ૨૦૦૦૧૦૯૦૦૦૪૬૨૪	તમામ ચલ અને અચલ સંપત્તિ જે ૩૨.૨૫ ચો.મી.નું માપન સર્વે નં.૩૨૦/૨, પ્લોટ નં.૪૧ પૈકી દક્ષિણ બાજુ, રઝા પાર્ક, ભેરુન્ડા રોડ, મુ–મોડાસા, તા–મોડાસા, જિ.–અરવલી–૩૮૩૩૧૫ સ્થિત છે અને જે આવરિત છેઃ ઉત્તરઃ પ્લોટ નં.૪૧ પૈકી, પૂર્વઃ ૬ મીટર પહોળો રોડ, પશ્ચિમઃ ૨.૨૫ મીટર પોતાનું માર્જિન પછી પ્લોટ નં. ૩૦નું ૨.૨૫ મીટર માર્જિન, દક્ષિણઃ પ્લોટ નં.૪૦	२५.०४.२०२४/ 03.२०.२०२3	३.४,१४,५१४.१२	૧૫.૦૫.૨૦૨૪

આ નોટિસ દ્વારા બેંક તમને પુનઃ ચૂકવાలી કરવાની માંગણી કરે છે જે પુનઃ ચૂકવાણી તમારા નામે રહેલી બાકી રકમ, વ્યાજ, ખર્ચ અને શૂલ્ક સિંદિત આ નોટિસની તારીખથી ૬૦ દિવસમાં ભરવાની રહેશે, જેમાં તમે નિષ્ફળ રહેશો તો બેંક સરફેસી (SARFAESI) કાયદાની કલમ ૧૩(૪) અન્વચે ઉક્ષેખિત કોઈ અથવા તમામ પ્રકારના પગલાં આગળના સમયમાં લઈ શકે છે. સિક્યોર્ડ એસેટને રીડીમ કરવા/પરંત મેળવવા ઉપલબ્ધ સમય સંદર્ભે એક્ટની કલમ ૧૩ની પેટા–કલમ (૮)ની જોગવાઈઓ તરફ કર્જદાર/મોર્ગેજ મૂકનારનું ધ્યાન દોરવામાં આવે છે. સ્થળઃ અરવછી અધિકૃત અધિકારી તારીખઃ ૨૨/૦૫/૨૦૨૪ બંધન બેંક લિમિટેડ

#### RELIGARE ENTERPRISES LIMITED

CIN: L74899DL1984PLC146935

Regd. Office: 1407, 14th Floor, Chiranjiv Tower, 43, Nehru Place, New Delhi – 110019

Statement of Standalone and Consolidated Audited Financial Results for the Quarter and Year Ended March 31, 2024

Standalana								(Rs. in Lakhs, unless otherwise stated)				
Particulars		Standalone  Quarter Ended Year Ended					Consolidated				Year Ended	
		March 31, 2024	Quarter Ended  December 31, 2023	March 31, 2023	March 31, 2024	March 31, 2023	March 31, 2024	Quarter Ended December 31, 2023	March 31, 2023	March 31, 2024	March 31, 2023	
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)	(Audited)	(Unaudited)	(Audited)	(Audited)	(Audited)	
1	Total Revenue from Operations	323.29	361.14	617.10	1,178.10	2,378.60	1,85,568.95	1,51,057.65	1,39,607.21	6,23,478.61	4,67,645.68	
2	Net Profit / (Loss) for the quarter/year (before Tax, Exceptional and /or Extraordinary Items, and share in loss of joint venture)	(1,499.07)	(2,597.23)	1,505.69	(7,187.55)	(1,509.83)	606.20	4,072.59	26,760.41	21,734.04	(3,077.78)	
3	Net Profit / (Loss) for the quarter/year before Tax (after Exceptional and /or Extraordinary Items and share in loss of joint enture)	(1,499.07)	(2,597.23)	1,505.69	(7,187.55)	(1,509.83)	23,640.82	4,072.59	3,55,701.48	44,768.66	3,25,863.29	
4	Total Comprehensive Income for the quarter/year (after Tax and non-Controlling Interest)	(1,515.12)	(2,581.57)	1,512.64	(6,582.30)	(1,507.36)	14,095.08	2,548.92	3,47,732.91	26,668.68	3,03,208.13	
5	Equity Share Capital (Paid-up)	32,972.12	32,948.62	32,355.95	32,972.12	32,355.95	32,972.12	32,948.62	32,355.95	32,972.12	32,355.95	
6	Other Equity (Excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet	N.A.	N.A.	N.A.	1,79,344.32	1,82,342.67	N.A.	N.A.	N.A.	2,01,342.00	1,73,412.56	
7	Earnings Per Share (EPS) before and after extraordinary items (of Rs 10/- each, fully paid up)											
	a. Basic EPS (Rs)	(0.45)	(0.76)	0.48	(1.98)	(0.47)	3.80	0.61	107.64	7.13	96.06	
	b. Diluted EPS (Rs)	(0.45)	(0.76)	0.48	(1.98)	(0.47)	3.76	0.58	105.91	7.07	94.67	

The above is an extract of the detailed format of Quarterly and Year ended Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter and Year ended Financial Results is available on the Company's website www.religare.com and Stock Exchanges' website www.nseindia.com and www.bseindia.com.

For and on behalf of the Board of Directors

Dr. Rashmi Saluja **Executive Chairperson** 

Phone: 011 – 44725676 | Website: www.religare.com | E-mail: investorservices@religare.com